

GJSK040044262025



મુદામાલ અરજ નં.૩૧૫/૨૦૨૫

ઈડર પો.સ્ટે. નં.૩૧૧૧૧૨૫૦૨૨૪૮૨૨/૨૦૨૫

અરજદાર અલ્પેશભાઈ જેસિંગભાઈ પટેલની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૪૯૭ અને ૫૦૩ ની અરજી હેઠળ હુકમ

- (૧) અરજી વંચાણે લીધી, સાંભળ્યા.
- (૨) આ કામે અરજદારે હાલની અરજી કરીને અરજ ગુજારેલ છે કે, અરજદારના બેન્ક નામે (૧) એચ.ડી.એફ.સી.બેન્કના ખાતા/ક્રેડીટ કાર્ડ નં. ૫૦૧૦૦૧૦૩૭૨૨૭૮૪ માંથી રૂ.૫૫,૪૦૦/- તથા (૨) ધી સાબરકાંઠા ડી.સે.કો.ઓ.બેન્ક લી., ના ખાતા/ક્રેડીટ કાર્ડ નં.૧૧૫૦૦૭૩૮૫૩૬૯ માંથી રૂ. ૨૪,૬૯૯/- આમ કુલ રૂ.૮૦,૦૯૯/- ઉપડી ગયેલ હતા જે બાબતે ફરીયાદીએ ૧૯૩૦ નંબર ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી જેની તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ ફરીયાદ નં.૩૧૧૧૧૨૫૦૨૨૪૮૨૨ થી નોંધાયેલ છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ ધ્વારા સામેવાળાના ખાતામાં ફરીયાદીના ગયેલ નાણાં પૈકી અમુક રૂપિયા બી.એન.એસ.એસની કલમ- ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા. જે હાલ સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને પરત મળેલ નથી અને અરજદારનું ખાતુ ફીઝ થયેલ છે. આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી અને અરજદારને આર્થિક રીતે નુકશાન થાય તેમ છે. સદર રૂપિયાથી અરજદારને ગુજરાન ચલાવવા ખુબ જ જરૂરીયાત હોય જેથી સદર નાણાં બેન્ક ખાતુ ફીઝ થયેલ છે તો બેન્ક ખાતુ અનફીઝ કરવા તેમજ અરજદારના ખાતામાં પરત મેળવવા હાલની આ અરજી કરેલ છે. સદરું નાણાં અરજદારના છે. તે બતાવવા ફરીયાદ નં.૩૧૧૧૧૨૫૦૨૨૪૮૨૨ ની નકલ, પાનકાર્ડ તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, ફરીયાદીના બેન્કની સ્ટેટમેન્ટ તથા પાસબુકની નકલ રજુ કરેલ છે અને સદરું નાણાં અરજદાર અંગત ઉપયોગ સારૂ જરૂર હોય તે પરત સોંપવા અરજ ગુજારેલ છે.
- (૩) અરજી સંદર્ભે પોલીસ અભિપ્રાય વંચાણે લેતાં, અરજદારશ્રીનાઓના સામાવાળા શંકાસ્પદ (૧) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતા નં. ૩૬૫૫૧૨૪૪૪૦૦ માં ગયેલ રૂ.૬૨૬.૨૬/-, (૨) ઇન્ડિયન બેન્ક

(ઇન્કલુડીંગ અલ્લાબાદ બેન્ક) ખાતા નં.૬૮૭૭૩૬૦૬૫૪ માં ગયેલ રૂ. ૧૬૯૦.૭૯/-, (૩) ઇન્ડિયન ઓપરાઇસ બેન્ક ખાતા નં. ૦૨૩૯૦૧૦૦૦૦૨૬૪૮૭ માં ગયેલ રૂ.૪૪૦૦/-, (૪) ઇન્ડસર્વિસ ખાતા નં.૧૦૦૨૬૯૮૫૪૦૩૮ માં ગયેલ રૂ.૩૨૦૪.૩૨/-, (૫) યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (ઇન્કલુડીંગ આંધ્રા બેન્ક એન્ડ કો.બેન્ક) ખાતા નં. ૨૧૦૧૨૨૦૧૦૦૦૨૧૩૦ માં ગયેલ રૂ.૫૨૬.૮૭/-, (૬) આઇ.ડી.બી.આઇ. બેન્ક ખાતા નં.૧૬૨૩૧૦૪૦૦૦૦૬૧૦૨૯ માં ગયેલ રૂ. ૧,૦૦૦/-, (૭) ઇન્ડિયન ઓપરાઇસ બેન્ક ખાતા નં. ૦૨૭૧૦૨૦૦૦૦૦૦૩૧૦ માં ગયેલ રૂ.૬૦૦/- તથા (૮) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતા નં.૦૦૦૦૦૦૪૪૩૫૮૨૭૯૯૭૫ માં ગયેલ રૂ.૫૧૦૦/- અરજદારના નાણાં તે ફીઝ થયેલ છે. સદર બેન્ક ખાતાઓ શંકાસ્પદ હોવાનું જણાઈ આવે છે અને સદરહું ખાતુ સીઝ કર્યા બાદ શંકાસ્પદ બેન્ક ખાતા ધારકોને અત્રેના પોલીસ સ્ટેશનથી તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ બેન્ક મારફતે ઇમેલ કરી દિન-૭ માં કોઈ રજુઆત હોય તો અત્રેના પોલીસ સ્ટેશન સંપર્ક કરવા જણાવેલ હોવા છતાં ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબત અમારા સમક્ષ કોઈ વાંધા તકરાર જણાવેલ નથી. જેથી તે રૂપિયા અરજદારશ્રીને ધી સાબરકાંઠા ડી.સે.કો.બેન્ક લી., ખાતા નં. ૧૧૫૦૦૭૩૮૫૩૬૯ IFSC CODE નં.GSCB0SKB065 માં પાછા આપવા તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે.

(૪) અરજદાર તરફે પોતાની અરજીમાં જણાવ્યા મુજબ ફીઝ કરેલ મુદામાલ નાણાં બાબતે તે બતાવવા ફરીયાદ નં. ફરીયાદ નં.૩૧૧૧૧૨૫૦૨૨૪૮૨૨ ની નકલ, પાનકાર્ડ તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, ફરીયાદીના બેન્કની સ્ટેટમેન્ટ તથા પાસબુકની નકલ રજુ કરેલ છે. આમ, રજુ થયેલ દસ્તાવેજોના આધારે અરજદાર અરજીમાં જણાવેલ રોકડ રકમના માલીક હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે.

(૫) વધુમાં, આ કામે પોલીસ અભિપ્રાય તેમજ તે સાથે રજુ દસ્તાવેજ પુરાવા ધ્યાને લીધા. અરજદારની અરજી ધ્યાને લેતાં મુદામાલ નાણાં જો વધુ સમય બેન્કમાં ફીઝ પડી રહે તો અરજદારને નુકશાન થાય તેમ જણાય છે અને હાલના અરજદારએ માલીક હોવાનું ફલીત થતુ હોય આ મુદામાલ પરત

સોપવો યોગ્ય અને વાજબી હોવાનું માનુ છું.

આમ, આ સંજોગોમાં મુદામાલ અરજદારને પરત સોપવામાં આવે તો તે યોગ્ય અને વ્યાજબી હોવાનું જણાઈ આવતુ હોઈ યોગ્ય શરતોને આધિન યોગ્ય રકમના જામીન અને જાત મુચરકો રજુ કર્યેથી અરજદારને મુદામાલ નાણાં પરત સોંપવા ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

:: હુકમ ::

૧. આથી અરજદાર અલ્પેશભાઈ જેસિંગભાઈ પટેલ, રહે.દેત્રોલી, પો.બડોલી, તા.ઈડર, જી.સાબરકાંઠાનાઓની મુદામાલ પરત મેળવવાની અરજી મંજૂર કરવામાં આવે છે.
૨. અરજદારશ્રી અલ્પેશભાઈ જેસિંગભાઈ પટેલનાઓના સામાવાળા શંકારપદ (૧) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતા નં. ૩૬૫૫૧૨૪૪૪૦૦ માં ગયેલ રૂ.૬૨૬.૨૬/-, (૨) ઈન્ડિયન બેન્ક (ઈન્કલુડીંગ અલ્હાબાદ બેન્ક) ખાતા નં.૬૮૭૭૩૬૦૬૫૪ માં ગયેલ રૂ.૧૬૯૦.૭૯/-, (૩) ઈન્ડિયન ઓવરાઈસ બેન્ક ખાતા નં. ૦૨૩૯૦૧૦૦૦૦૨૬૪૮૭ માં ગયેલ રૂ. ૪૪૦૦ /-, (૪) ઈન્ડસર્વિસ ખાતા નં.૧૦૦૨૬૯૮૫૪૦૩૮ માં ગયેલ રૂ. ૩૨૦૪.૩૨/-, (૫) યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (ઈન્કલુડીંગ આંધ્રા બેન્ક એન્ડ કો.બેન્ક) ખાતા નં.૨૧૦૧૨૨૦૧૦૦૦૨૧૩૦ માં ગયેલ રૂ.૫૨૬.૮૭ /-, (૬) આઈ.ડી.બી.આઈ. બેન્ક ખાતા નં.૧૬૨૩૧૦૪૦૦૦૦૬૧૦૨૯ માં ગયેલ રૂ.૧,૦૦૦/-, (૭) ઈન્ડિયન ઓવરાઈસ બેન્ક ખાતા નં. ૦૨૭૧૦૨૦૦૦૦૦૦૩૧૦ માં ગયેલ રૂ.૬૦૦/- તથા (૮) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતા નં.૦૦૦૦૦૦૪૪૩૫૮૨૭૯૯૭૫ માં ગયેલ રૂ.૫૧૦૦/- ફીઝ થયેલ છે તે ખાતુ અનફીઝ કરવા તેમજ સદર ખાતામાંથી તે રૂપિયા અજદારશ્રીને ધી સાબરકાંઠા ડી.સે.કો.બેન્ક લી., ખાતા નં. ૧૧૫૦૦૭૩૮૫૩૬૯ IFSC CODE નં.GSCB0SKB065 માં વચગાળાની કરટડીએ પાછા સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

શરતો :-

- ૧) અરજીમાં જણાવેલ શંકારપદ (૧) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતા નં. ૩૬૫૫૧૨૪૪૪૦૦, (૨) ઈન્ડિયન બેન્ક (ઈન્કલુડીંગ અલ્હાબાદ

બેન્ક) ખાતા નં.૬૮૭૭૩૬૦૬૫૪, (૩) ઇન્ડિયન ઓવરાઈસ બેન્ક ખાતા નં. ૦૨૩૯૦૧૦૦૦૦૨૬૪૮૭, (૪) ઇન્ડસર્વિસ ખાતા નં. ૧૦૦૨૬૯૮૫૪૦૩૮, (૫) યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (ઇન્કલુડિંગ આંધ્રા બેન્ક એન્ડ કો.બેન્ક) ખાતા નં.૨૧૦૧૨૨૦૧૦૦૦૨૧૩૦, (૬) આઈ.ડી.બી.આઈ. બેન્ક ખાતા નં.૧૬૨૩૧૦૪૦૦૦૦૬૧૦૨૯, (૭) ઇન્ડિયન ઓવરાઈસ બેન્ક ખાતા નં. ૦૨૭૧૦૨૦૦૦૦૦૦૩૧૦ તથા (૮) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતા નં.૦૦૦૦૦૦૪૪૩૫૮૨૭૯૯૭૫ માં સ્થગિત થયેલ રકમ અરજદારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેટલીજ રકમના જામીન તથા તેટલી જ રકમનો જાતમુચરકો રજુ કરેથી પરત કરવાનો હુકમ કરવામાં આવે છે.

- ૨) અરજદારે પોલીસ સ્ટેશનમાં જામીન રજુ કરેથી પોલીસે સ્થગિત કરેલ રકમ પરત કરવા જે તે સંબંધિત ખાતાવાળી બેન્કને યાદી કરવાનો આદેશ આપવામાં આવે છે.
- ૩) જો સદર રકમનો અન્ય કોઈ વ્યક્તિ કલેઈમ કરશે કે અન્ય વ્યક્તિની જણાઈ આવશે તો સદર રકમ અરજદારે અત્રેની કોર્ટમાં જમા કરાવાની રહેશે.

હુકમ આજરોજ તા.૦૬-૦૭-૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં પાંચી, સંભળાવી, સહી કરી જાહેર કર્યો.

સ્થળ: ઇડર
તા.૦૬/૦૭/૨૦૨૬

(ડૉ.સ્તુતિ.ડી.કાપડીયા)
એડી.ચીફ જ્યુડી. મેજ.મુ.ઇડર
જજ કોડ નં.જી.જે ૦૧૩૫૬

//Mahavir//